

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા CGST અમદાવાદ ખાતે મળેલ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીની મિટીંગમાં ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ...

CGST અમદાવાદ ખાતે ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી ફોર ટેક્ષપેયર ઓન જીએસટી ઈશ્યુ અંગે માનનીય પ્રિન્સીપાલ ચીફ કમિશ્નરશ્રીમતી સિમા અરોરાની અધ્યક્ષતામાં તા.૨૪-૨-૨૦૨૨ ના રોજ મિટીંગ યોજવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ઉપસ્થિત રહી GST અંતર્ગત પડતી મુશ્કેલી અંગે વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ તેમજ આ પ્રશ્નોનું કેન્દ્ર સરકારની GST કાઉન્સીલમાં રજુઆત કરવા ભારપૂર્વક અનુરોધ કરેલ છે.

(૧) CGST ના સરકયુલરનં.૩૭/૨૦૧૮-કસ્ટમ્સ, તા.૮-૧૦-૨૦૧૮ ની પ્રસિધ્ધિ બાદ જે નિકાસકારોના ડ્યુટી ડ્રોબેક રેઈટ ઉચ્ચતમ કે સમાનતમ હોય તેના CGST રીફંડ માટેના દાવા માન્ય રાખવામાં આવતા નથી. HSN ડેક્લેરેશન સમયે નિકાસકાર શિપીંગ બીલમાં A અથવા C મુજબ રીફંડ માંગે તો આવા રીફંડ સિસ્ટમમાં મળતા નથી. મોટાભાગના કિસ્સામાં શીપીંગ બીલ CHA દ્વારા ફાઈલ કરાયું હોય અને તેમાં ડ્યુટી ડ્રોબેક ના ઉચ્ચતર રેઈટની માંગણી કરવામાં ભુલ થવાના કિસ્સામાં ક્લેઈમ નામંજુર થાય છે. તેથી શિપીંગ બીલમાં નિકાસકારો દ્વારા સાચી અને વાસ્તવિક ભુલ A અથવા C સિલેક્ટ કરેલ હોય તેઓને મેરીટના આધારે અરજી માન્ય રાખવી. તેમજ મોટા નિકાસકારોએ આના માટે કેસ જીતીને રીફંડ મેળવી લીધેલ છે ત્યારે નાના નિકાસકારોને નાના રીફંડ માટે કોર્ટ ફી પોસાય શકે તેમ નથી. તો આ અંગે તાત્કાલીક યોગ્ય કરવું.

(૨) રીવર્સ ચાર્જ મીકેનીઝમ (RCM) અંતર્ગત નિકાસકારો ઘણી મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેમાં સામાન્ય રીતે માલ મોકલનાર / ટ્રાન્સપોર્ટર GST ચુકવવા માટે જવાદાર છે. તેમના દ્વારા મોકલાયેલ માલ સામાન્યની GST પેટેની રકમ તેમણે પોતે વસુલવાની અને ભરવાની હોય છે. નિકાસકાર તરીકે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પેટે ભરેલ GST નું રીફંડ મેળવે છે. આવા કિસ્સામાં સરકારશ્રીને ટેક્સ પેટે કોઈપણ પ્રકારનું નાણાક્રિય નુકશાન થતું ન હોવા છતાં ઓડિટ સમયે આવી GST ની રકમ દંડ સહિત વસુલવામાં આવે છે. તો બાબતે તાત્કાલીક યોગ્ય કરવું.

(૩) સમગ્ર GST પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઈ તબક્કે કોઈ જાતની ગેર રીતી આચરવામાં આવે તો છેલ્લો વ્યવહાર કરનાર વ્યક્તિએ ભોગ બનવું પડે છે કે જેને નિયમોનુસાર મળવાપાત્ર ITC મેળવેલ હોવા છતાં તેને રીવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં દર્શાવેલ સદર ક્ષતીના નિવારણ અર્થે ટેક્સ પેયર દ્વારા કેવા સલામતીભર્યા પગલા હોવા જરૂરી છે તે સબબ રજુઆત કરવામાં આવે છે. GST એક્ટમાં ટેક્સ પેયરની સલામતી માટે યોગ્ય અને યુસ્ત પ્રાવધાન કરવા જરૂરી છે.

ઉપરોક્ત પ્રશ્નોની રજુઆતના અનુસંધાને માનનીય પ્રિન્સીપાલ ચીફ કમિશ્નરશ્રીમતી સિમા અરોરાએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વર્ષ ૨૦૨૨-૨૩ માટેના બજેટને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે...

ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું આશરે ૨.૪૩ લાજર કરોડનું પ્રથમ બજેટ રજુ કરવામાં આવેલ. ગુજરાત રાજ્યના વિકાસને વધુ વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા રજુ કરાયેલ બજેટને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે.

ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પુર્ણતાની સાથે દેશ ૫ ટ્રીલીયન અર્થતંત્રમાં આગળ વધી રહ્યું છે. તેમાં ગુજરાત રાજ્યએ પણ વિકાસલક્ષી બજેટ આપીને સુર પુરાવેલ છે. આ બજેટમાં ગાંધીનગરના ગીફ્ટ સીટી ખાતે દેશનું પ્રથમ બુલીયન માર્કેટ શરૂ થશે, તેમજ વિશ્વ બેન્કની સહાયથી આશરે દશ લાજર કરોડના ખર્ચે સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે જે સારી બાબત કહી શકાય. ખાસ કરીને સ્ટાર્ટઅપને મદદરૂપ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી ૨.૦ જાહેર કરેલ તેમજ ઉદ્યોગ જગતને ૭ લાજર ૩૦ કરોડનું ફંડ ફાળવવામાં આવેલ છે. જેથી ગુજરાતના તમામ નાના ઉદ્યોગકારોને સાડા એવું બુસ્ટ મળશે. સાથો સાથ આ બજેટમાં કરેલી જોગવાઈઓ જોતા આ બજેટ ખેડુતોને સહકાર વિભાગ દ્વારા ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીમાં સારી એવી ક્રાંતિ આવશે. આ બજેટમાં આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવેલ છે અને શિક્ષણ જગતને પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેમજ શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસ, તેમજ માર્ગ વાહન વ્યવહારને સારી એવી રકમ આપી ગુજરાત રાજ્યને માળખાકીય સુવિધા ઉપલબ્ધ થશે અને ઉદ્યોગોને વેગ મળશે.

આમ ગુજરાત રાજ્યનું આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગલક્ષી, ગ્રામ્યલલક્ષી, ખેડુતલક્ષી, અને ખાસ કરીને શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી કહી શકાય. આ બજેટથી સાર્વત્રીક સ્તરે વિકાસ થશે અને દેશના અર્થતંત્રના વિકાસમાં પણ સહભાગી બની રહેશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા Entrepreneurship Development Institute of India (EDII) નાં સંયુક્ત ઉપક્રમે “Professionalizing Your Family Business” અંગે સેમિનાર યોજવામાં આવ્યો...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા Entrepreneurship Development Institute of India (EDII) નાં સંયુક્ત ઉપક્રમે “Professionalizing Your Family Business” અંગે તા.૬-૩-૨૦૨૨ ના રોજ સેમિનાર યોજવામાં આવેલ. જેમાં EDII ના ફેમિલી બિઝનેસ એડવાઈઝ ડો. નટરાજન કિષ્નન તથા ફેકલ્ટીશ્રી ઉમેશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહી જાણકારી-માર્ગદર્શન આપેલ.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના માનદત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ ઉપસ્થિત વક્તાશ્રીઓ તથા સભ્યોશ્રીઓને આવકારી પારિવારિક વ્યાપારનો ગ્રોથ કેવી રીતે કરવો અને પારિવારિક સભ્યો દ્વારા વ્યાપારને ભવિષ્યમાં કેવી રીતે ટકાવી શકાય તે અંગે આ મહત્વના સેમિનારનું આયોજન કરેલ છે. જે સૌને ખુબ જ ઉપયોગી બની રહેશે. તેમ જણાવેલ.

સેમિનારના મુખ્ય વક્તાશ્રી નટરાજન કિષ્નન તથા શ્રી ઉમેશ શ્રીવાસ્તવએ આજના સેમિનારનું આયોજન કરવા બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યક્ત કરેલ. તેમજ પારિવારિક વ્યવસાયને વ્યવસાયિક કેવી રીતે બનાવી શકાય તે માટેના પડકારો, ઉજ્જવળ તકો તથા તેને આનુશાંગિક વિવિધ પાસાઓની પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા સંપૂર્ણ જાણકારી આપેલ.

શ્રી ઉમેશ શ્રીવાસ્તવએ EDII ખાતે ચાલી રહેલ ઉદ્યોગસાહસીક બનવાની તકો અને Entrepreneurship માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ પ્રોગ્રામની મુખ્ય લાક્ષણિકતાઓ અંગે વિગતવાર માહિતી આપેલ.

ત્યાર બાદ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ જણાવેલ કે રાજકોટ ચેમ્બર દ્વારા સરકારશ્રી તથા વિભાગો દ્વારા જાહેર કરાતા નવા નિતી નિયમો તથા પોલીસીઓ તેમજ વેપાર-ઉદ્યોગને આનુશાંગિક વિષયોની સંપૂર્ણ જાણકારી સભ્યશ્રીઓ તથા આમ જનતાને મળી રહી તે માટે અવાર-નવાર સેમિનારો તથા મિટીંગોનું આયોજન કરવામાં આવે છે. આવનારા દિવસોમાં વેપાર-ઉદ્યોગકારો પોતાના વ્યવસ્યાનો વિકાસ કઈ રીતે કરી શકે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ ટકાવી શકે તે માટે આ સેમિનાર ખુબ જ મહત્વનો સાબીત થશે. તેમ જણાવેલ. સેમિનારના અંતે રાજકોટ ચેમ્બરના ખજાનચીશ્રી વિનોદભાઈ કાછડીયા દ્વારા ઉપસ્થિત વક્તાશ્રીઓ તથા સભ્યોશ્રીઓનો સેમિનારમાં હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળ સાથે પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી સમક્ષ વેપાર-ઉદ્યોગને પડતી મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ લાવવા માટે વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૭ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા છે. રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનું યોગ્ય અને સચોટ નિરાકરણ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા વિવિધ વિભાગોમાં એક સેતુ બની કાર્ય કરી રહ્યું છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગોના પ્રશ્નોને ત્વરિત ન્યાય મળે તે માટે રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ રાજકોટ ચેમ્બરના હોદ્દેદારો તેમજ રાજકોટના વિવિધ એસોસિએશનોના હોદ્દેદારોને સાથે રાખીને તા.૭-૩-૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી રૂબરૂ મુલાકાત લઈ વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ. આ મુલાકાત ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ડો. ભરતભાઈ બોધરા તેમજ વાહનવ્યહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના નેજા હેઠળ સફળ થયેલ.

(૧) સમગ્ર દેશમાં તમામ ટેક્સનો એકજ ટેક્સ કરવાના નિર્ણયના ભાગરૂપે GST નું સરળીકરણ કર્યું જે સરાહનીય છે. વન નેશન વન ટેક્સને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાંથી વેપાર-ઉદ્યોગ પરનો વ્યવસાય વેરો સંપૂર્ણ પણે નાબુદ કરવો. હાલમાં બજેટમાં સરકારશ્રીએ રૂ.૧૫૦૦૦ હજાર સુધીનાં પગારદાર લોકોને વ્યવસાય વેરા માંથી મુક્તી આપી છે. જેની રકમ આશરે રૂ.૧૮૮ કરોડ થાય છે અને ગુજરાતની કુલ આવક માત્ર રૂ.૩૦૦ કરોડ થાય છે તો માત્ર રૂ.૧૦૦ કરોડની આવક બીજે મેનેજ કરવામાં આવે તેમજ આ પ્રોફેશનલ

ટેક્સ સંપૂર્ણ પણે રદ કરવો એ સમગ્ર ગુજરાતના વેપારીઓની માંગણી હોય આ બજેટમાં જ રદ કરવાની રાજકોટ ચેમ્બર દ્વારા ભારપૂર્વક રજૂઆત કરેલ હતી.

(૨) રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ ઘણી MSME ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય રાજકોટ ખાતે ઈનવેન્ડ કન્ટેઈનર ડેપો (ICD) સ્થાપવા માટેની અમારી માંગણી છે. આ અંગે ૨૦૧૭ ના વાર્ષિક ગુજરાતમાં MOU થયેલ હોય જેનો આજ દીન સુધી કોઈ નીરાકરણ આવેલ નથી. તો રાજકોટ ખાતે ICD સ્થાપવાની માંગણી સ્વીકારી યોગ્ય કરવું. જેથી નિકાસકારોના ઉદ્યોગમાં ફાયદો થાય અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ મળે.

(૩) રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવવાની માંગણી ઘણા સમયથી પેન્ડીંગ છે. પુર્વ મુખ્યમંત્રીશ્રીએ આ માંગણીનો સ્વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે ૩૨ એકર જગ્યાનું સ્માર્ટ સીટી એરીયામાં પ્રોવીડન કરેલ હોય આ અંગે તાત્કાલીક નિર્ણય લઈ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવી રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર તાત્કાલીક ફાળવવું.

(૪) રાજકોટ ચેમ્બરને પોતાની બિલ્ડીંગ બનાવવા માટે રાહત દરે જમીન ફાળવવા માટેની વર્ષો જુની માંગણી પેન્ડીંગ હોય. તો તાત્કાલીક અસરથી ૧૦ હજાર ચો. મીટર જગ્યા ટોકન દરે ફાળવવી.

(૫) રાજકોટ ખાતે ઈમિટેશન જવેલરી પાર્ક મંજૂર કરવું. કારણ કે, સમગ્ર ભારતમાં સૌથી વધારે ઈમિટેશનનું પ્રોડક્શન રાજકોટમાં થાય છે. આ ઉદ્યોગ ગુલુ ઉદ્યોગ હોય આશરે ૪.૫ લાખ લોકોને રોજગારી પુરી પાડે છે. જે પૈકી આશરે ૨.૫ લાખ મહિલાઓને રોજગારી મળે છે. તેથી રાજકોટ ખાતે ઈમિટેશન જવેલરી પાર્ક સ્થાપવાથી ઈમિટેશન ઉદ્યોગોને વેગ મળશે તેમજ લાખો લોકોને રોજગારી મળશે.

(૬) ગુજરાતની નવી ઔદ્યોગીક નિતી-૨૦૨૦ જાહેર થયેલ છે. તેમાં રાજકોટના તાલુકાઓને કેટેગરી ૧,૨,૩ માં મુકવામાં આવેલ છે. આમા સૌરાષ્ટ્રને હળાહળ અન્યાય થયેલ છે. જેથી તેનો વિકાસ અટકી ગયેલ છે. જેથી તેમાં મહદઅંશના તાલુકાઓમાં ફેરફાર કરવો જરૂરી છે. જેથી નવા સ્થપાતા ઉદ્યોગોને સરકારના તમામ લાભો મળવાપાત્ર થાય. જેથી સૌરાષ્ટ્રના ઉદ્યોગો ખીલી ઉઠશે. આ અંગે ઉદ્યોગ કમિશ્નરશ્રીને રજૂઆત પણ કરેલ છે અને આ વિસંગતતા દૂર થવાથી MSME ને ફાયદો થશે.

(૭) આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે ડિકેન્સના હથીયારો ભારત દેશમાં જ બને અને ભારત આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી ડિકેન્સ પોલીસીને ખુબ પ્રોત્સાહીત કરેલ હોય. તેમજ રાજકોટ માંથી ઘણી બધી ઈન્ડસ્ટ્રીઓ ડિકેન્સને ડાયરેક્ટ તથા ઈનડાઈરેક્ટ સપ્લાય કરતી હોય. તેમને સરકાર પાસેથી ઉદ્યોગોના વિકાસ માટે જમીન મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. તો હાલમાં ડિકેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસી તેમજ ગુજરાતની નવી ઔદ્યોગીક નીતીમાં ઘણી વિસંગતતાઓ હોય જેને દૂર કરી આ અંગે તત્કાલીક અસરથી ઘટતું કરવું. જેથી ડિકેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સુધારા કરવાથી આવા ઉદ્યોગોને પ્રોત્સાહીત કરી શકાય અને મોદી સાહેબના સપનાને સાકાર કરી શકાય.

(૮) ગુજરાતમાં ઘણી બધી MSME ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ MSME ની મર્યાદા આશરે ૫૦ કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમાં રાખીને GIDC માં ૩૦૦૦ ચો.મી.ને બદલે જો ૬૦૦૦ ચો.મી. જમીન ઉદ્યોગકારોને ૫૦ ટકાના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ.એસ.એમ.ઈ સેક્ટરને બુસ્ટ મળશે.

(૯) ઘણાં વખતથી ગુજરાતની GIDCઓ ડબલ ટેક્સ ભરવાથી પીડાય છે. તેમજ મહાનગરપાલિકા/ નગરપાલિકા તથા સરકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેથી ઔદ્યોગીક એકમોન મહાનગરપાલિકા તથા GIDC ને ભરવાપાત્ર થતા ડબલ ટેક્સનું યોગ્ય નિરાકરણ લાવવું. જેથી ઉદ્યોગકારોને મળવાપાત્ર તમામ સુવિધા મળે અને ઉદ્યોગોનો વિકાસ થાય.

(૧૦) ગુજરાત સરકાર દ્વારા રેસીડેન્ટ સોસાયટીઓ રેગ્યુલાઈઝ કરીને સરાહનીય પગલું લીધેલ છે. ત્યારે તમામ સુચિત ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ પણ તાત્કાલીક અસરથી ટોકન દરે રેગ્યુલાઈઝ કરવી. આનાથી સરકારને રેવન્યુની આવક પણ વધશે તથા ઉદ્યોગોનો વિકાસ થશે. તેમજ આવી વસાહતોમાં આવારા તત્વો દ્વારા દબાણ પણ નહિ થાય તે પણ ધ્યાને લઈ ઘટતું કરશો.

(૧૧) રાજકોટ ખાતે રામનગર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઔદ્યોગીક એકમોને ધારાધોરણ મુજબની ફી લઈને રેગ્યુલાઈઝ કરવાની માંગણી પેન્ડીંગ હોય તો તે અંગે ઘટતું કરશો.

- (૧૨) રાજકોટમાં દીન પ્રતિદીન ઉદ્યોગો વધી રહ્યા છે. જેથી રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસે અને રાજકોટ-ભાવનગર હાઈવે પર ગઢડા પાસે સરકારી ખરાબાની જમીન આવેલ હોય ત્યાં નવી તાત્કાલીક નવી જીઆઈડીસી ફાળવવી. જેથી ઉદ્યોગોના વિકાસની સાથે રોજગારીની તકોમાં વધારો થશે.
- (૧૩) સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ આપવા ઘણી બધી ઈન્ડસ્ટ્રીઓ નવી બની રહેલ હોય તેમને યોગ્ય સમયે વીજ પુરઠો મળતો નથી તો આ અંગે તાત્કાલીક પગલા લઈ ૬૬ કે.વી. સબ સ્ટેશન બનાવવા માટે જેટકોને તાત્કાલીક જમીન ફાળવવી જેથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે.
- (૧૪) રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર માલીયાસણ ગામ નજીક બનનાર ટોલ પ્લાઝાને જુના હૈયાત બામણબોર ટોલપ્લાઝામાં ફેરવવું.
- (૧૫) રાજકોટ શહેરમાં અંદાજે ૧૭ વર્ષથી રૂડાના ચેરમેનની જગ્યા ખાલી હોય તેનો ચાર્જ શહેરના IAS અધિકારી પાસે હોય તેઓ પોતાના કાર્યભારના અભાવે હાજરી આપી શકતા ન હોય જેથી રાજકોટનો વિકાસ અટકી ગયેલ છે. તો માત્ર રાજકોટને જ આ અન્યાય શા માટે ? અમદાવાદ-બરોડા- સુરત-ભાવનગર જેવા શહેરોમાં ચેરમેનો હોય તો રાજકોટને કેમ નહીં ? તો રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની નિમણૂંક કરવી.
- (૧૬) કોઈપણ શહેરનો વિકાસ તેમનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા થાય છે. રાજકોટને રીંગ રોડ-૧, રીંગરોડ -૨ તેમજ પ્રપોઝ રીંગ રોડ-૩ ની મંજૂરી મળેલ હોય, ઘણા લાંબા સમયથી રીંગ રોડ-૨ નું કાર્ય અધૂરું છે. આજની તારીખે પણ રીંગ રોડ - ૨ પૂર્ણ થયેલ નથી. જેના કારણે રાજકોટમાં પારાવર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથોસાથ ઉદ્યોગકારોને પણ ટ્રાન્સપોર્ટેશનમાં ખુબ જ હાલાકી ભોગવાઈ રહી છે. તો આ રીંગ રોડ -૨, ૪ ટ્રેકનું કાર્ય પૂર્ણ કરવા અમારા ધ્યાનમાં આવ્યા મુજબ રૂડા/રાજકોટ મહાનગરપાલિકા એ પણ દરખાસ્ત કરેલ હોય તાત્કાલીક અસરથી આ બજેટમાં આના ખર્ચનો સમાવેશ કરી સુધારો કરવો જેથી રાજકોટના ઉદ્યોગોને સારો એવો ફાયદો થશે.
- (૧૭) શહેરમાં સંચાલીત ચાલતા ડાયગ્નોસ્ટીક સેન્ટરોને તથા હોસ્પિટલોને હેલ્થકેરને લગતા સાધનો વસાવવા માટે હેલ્થકેર પોલીસીમાં ફેરફાર કરી તેઓને સબસીડી મળવાપાત્ર થાય તેવી જોગવાઈ કરવી.
- (૧૮) કોઈપણ રાજ્યનો વિકાસ કરવા માટે તમામ મોટા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ એસોસીએશનો સ્થપાયેલ છે. ચેમ્બર કાયમી ધોરણે પારદર્શક તેમજ તટસ્થતા પૂર્વક કામગીરી કરે છે. અને આમ પ્રજા વેપારીઓ ઉદ્યોગકારો તેમજ સરકારશ્રીને ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ મદદરૂપ થાય છે. આમ જો રાજકોટમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેજા નીચે વિવિધ એસોસીએશનોને સાથે રાખીને તેમજ કલેક્ટરશ્રી, પોલીસ કમિશ્નરશ્રી, મ્યુનીસીપીલ કમિશ્નરશ્રી, એમ.ડી. પી.જી.વી.સી.એ.લ તેમજ રૂડા અધ્યક્ષશ્રીની એક સંકલન સમીતીની રચના નામદાર કલેક્ટરશ્રીની અધ્યક્ષાતામાં કરવામાં આવે તો ઘણા બધા નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે.
- (૧૯) સરકારશ્રીની ક્રીટીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અન્વયે ફાયર સ્ટેશન પ્રોજેક્ટ કુલ પ્રોજેક્ટના ૮૦% મુજબ સરકારી સહાય ઉદ્યોગ કમિશ્નરશ્રીની કચેરીના પત્ર ક્રમાંક ઉક/આઈ.એમ./મંજૂરી/૧૫૫૮૪૭૬ તા.૨૨-૭-૨૦૧૮ થી મંજૂર થયેલ છે. જેમાં ફાયર ફાઈટર (બંબો) ની રકમનો સમાવેશ થયેલ નથી. તેથી શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહત માટે એસોસીએશન મારફત ફાયર સ્ટેશન પ્રોજેક્ટ માટે ફાયર ફાઈટર (બંબો) ની રકમ મંજૂર કરવી.
- (૨૦) સરકારશ્રીના નિયમ મુજબ નગરપાલિકા મળવાપાત્ર થાય છે. તેથી શાપર-વેરાવળની બન્ને ગામની સંયુક્ત નગરપાલિકાને મંજૂરી આપવી.
- (૨૧) રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામની આજુબાજુ મોટા પ્રમાણમાં ઔદ્યોગીક વસાહતો આવેલ છે. તે બન્ને ગામની કુલ વસ્તી અંદાજે ૧.૫ લાખથી પણ વધારે છે ત્યાં ફેક્ટરીમાં કામ કરતા મજૂરો, કારીગરો તથા રહેણાંક વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે અંગે યોગ્ય કરવું.
- (૧) આમ ખાસ કરીને રાજકોટના સર્વાંગી વિકાસ માટે બીજો રીંગ રોડ તાત્કાલીક પૂર્ણ કરવો.
(૨) પ્રોફેશનલ ટેક્ષ સંપૂર્ણ પણે નાબુદ કરવા અંગે.
(૩) રાજકોટને સ્માર્ટ સીટી એરીયામાં કન્વેન્શન સેન્ટર તેમજ રાજકોટ ચેમ્બરને જગ્યા ફાળવવા અંગે.
(૪) રાજકોટ ખાતે ઈમીટેશન જવેલરી પાર્ક ફાળવવા અંગે.

- (૫) GIDCના ડબલ ટેક્ષોશન રદ કરી પૂરતી સુવિધા આપવા અંગે તેમજ GIDC ને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા અંગે.
 (૬) સુચીત ઈન્ડસ્ટ્રીઅલ સોસાયટીઓ રેગ્યુલાઈઝ કરવા અંગે.
 (૭) માલીયાસણ ટોલ પ્લાઝા ફેરવવા અંગે.
 (૮) રાજકોટ ચેમ્બરના નેજા હેઠળ વિવિધ એસોસિએશનને સાથે રાખી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની રચના કરવા અંગે ભારપૂર્વક રજુઆત કરેલ.

આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રાજકોટના વિવિધ એસોસિએશનના પ્રશ્નોની રજુઆત કરવા માટે સૌ એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો. ભરતભાઈ બોધરા તથા વાહન-વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલજીને ધારદાર રજુઆત કરેલ હતી. આ મુલાકાત દરમ્યાન રાજકોટ ચેમ્બરના માનદમત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્યશ્રી કુમનલાલ વરસાણી, શ્રી નિલેશભાઈ ભલાણી તથા રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખશ્રી પરેશભાઈ ગજેરા, મંત્રીશ્રી સુજીતભાઈ ઉદાણી, રાજકોટ એન્જનીયરીંગ એસોસિએશનના પ્રમુખશ્રી પરેશભાઈ વસાણી, મંત્રીશ્રી નરેન્દ્રભાઈ પાંચાણી, લોધિકા જીઆઈડીસી ઈન્ડ. એસોસિએશનના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ઈમિટેશન જવેલરી એસોસિએશનના પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ શાહ તથા તેમની ટીમ, હડમતાળા ઈન્ડ. એસોસિએશનના મંત્રીશ્રી બંકિમ મહેતા, સંસ્કાર ઈન્ડ. એસોસિએશનના પ્રમુખશ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખશ્રી હસુભાઈ ભગદેવ, લોહડા-પડવલા ઈન્ડ. એસોસિએશનના પ્રમુખશ્રી જયંતિભાઈ સરધારા, રામનગર ઈન્ડ. એરીયા એસોસિએશનના પ્રમુખશ્રી રમેશભાઈ હિરપરા, ગુજરાત મીની સિમેન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી અરવિંદભાઈ શાહ, ભાગ્યલક્ષ્મી ઈન્ડ. એસોસિએશનના પ્રમુખશ્રી રાજુભાઈ રાણપરીયા વગેરે વિવિધ એસોસિએશનોના મોટી સંખ્યામાં હોદ્દેદારોને સાથે રાખી રજુઆત કરાયેલ હતી.

રાજકોટના સર્વાંગી વિકાસ માટે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખશ્રી પરેશભાઈ ગજેરાએ સારી એવી રજુઆત કરેલ હતી.

રાજકોટ એન્જનીયરીંગ એસોસિએશનના પ્રમુખશ્રી પરેશભાઈ વસાણી દ્વારા જીઆઈડીસીને લગતા વિવિધ પ્રશ્નો અંગે શ્રી થેનારસન સાહેબ સમક્ષ રજુઆત કરેલ હતી.

આ મુલાકાત દરમ્યાન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી દ્વારા સારો એવો સમય ફાળવી વિવિધ પ્રશ્નોની કરાયેલ રજુઆત અંગે સકારાત્મક પ્રતિભાવ આપી આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપેલ. આ પ્રશ્નોની રજુઆત સમયે માનનીય સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાજી, શ્રી રામભાઈ મોકરીયાજી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલજી તથા શ્રી લાખાભાઈ સાગઠીયાજી, રાજકોટના મેયરશ્રી ડો. પ્રદિપભાઈ ડવ તથા શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મિરાણીને સાથે રાખી રજુઆત કરી હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સફળ રજુઆત...

નિકાસકારોને MEIS સ્કીમ હેઠળ મળવાપાત્ર લાભો તથા પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર વ્યાજ સહાયની સમય મર્યાદા વધારવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઔદ્યોગીક, વાણીજયીક તથા આયાત-નિકાસ કરતા એકમોને કોરોના વૈશ્વિક મહામારી દરમ્યાન અસહ્ય નુકશાની તથા હાલાકી ભોગવવી પડેલ. આવા નિર્દેશીત એકમોને રાહત તથા સહાય પુરી પાડવા માટે રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્ર સરકારમાં અગાઉ રજુઆતો કરેલ. જે અંતર્ગત કેન્દ્ર સરકારે Interest Equalization Scheme જાહેર

કરેલ હતી. જે અંતર્ગત નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પ્રિ અને પોસ્ટ શીપમેન્ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્યાજ સહાય ચુકવવામાં આવે છે. જેની સમય મર્યાદા તા.૩૦-૯-૨૦૨૧ ના રોજ પુર્ણ થયેલ હતી. આ યોજનાને સરકાર દ્વારા વધુ લંબાવવામાં આવેલ પરંતુ કોઈપણ પ્રકારનું જાહેરનામું પ્રસિધ્ધ ન થવાના કારણે નિકાસકારોને બેન્કો દ્વારા અપાતા લાભો-સહાયો મળતા ન હતા. તેથી આ યોજનાની સમય મર્યાદા વધારાવા રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજી, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયેલજી તથા સાંસદશ્રી રામભાઈ મોકરીયાજી સમક્ષ રજુઆત કરેલ હતી. જેના ફળસ્વરૂપે આ યોજના અંતર્ગત મળવાત્ર ૩% વ્યાજ સહાયની સમય મર્યાદા તા.૩૧ માર્ચ ૨૦૨૪ સુધી કરવામાં આવેલ છે.

વધુમાં સરકારશ્રીની ફોરેન ટ્રેડ પોલીસી ૨૦૧૫-૨૦૨૦ અંતર્ગત નિકાસકારોને MEIS સ્કીમ હેઠળ વિવિધ લાભો મળવાપાત્ર થતા હોય છે. જેમાં DGFT દ્વારા Certain Duty Credit Scrip Based Schemes ની સમય મર્યાદા સુધારી વધુ લંબાવવામાં આવી છે. જેમાં (૧) ફોરેન ટ્રેડ પોલીસી અંતર્ગત મહત્તમ ફાળવણી તા.૧-૯-૨૦૨૦ થી ૩૧-૧૨-૨૦૨૦ સુધીના MEIS ના લાભો રૂ.૫ લાખ કરોડ દુર કરી આજ સમયગાળા દરમ્યાન નિકાસ કરેલ હોય તેવા નિકાસકારોને IEC દીઠ રૂ. ૨ કરોડ સુધીનો MEIS નો લાભ લેવા માટેની અરજી કરી શકશે. (૨) તા.૧-૪-૨૦૨૦ થી ૩૧-૧૨-૨૦૨૦ દરમ્યાન કરેલ નિકાસ દરમ્યાન MEIS નો લાભ મેળવવા માટે ક્લેઈમ રજુ કરવાની છેલ્લી તા.૩૧-૧-૨૦૨૦ કરેલ હતી જે સુધારી તા.૩૦-૪-૨૦૨૨ સુધી વધારવામાં આવેલ છે. જેમાં ૨% વધારાનો એડ-હોક આ છેલ્લી તારીખ સુધી જ મળશે. (૩) Rebate of State and Central Levies Taxes (RoSCTL) Scheme અંતર્ગત આર્ટિકલ્સ અને ગારમેન્ટની નિકાસ તા.૭-૩-૨૦૧૯ થી ૩૧-૧૨-૨૦૨૦ દરમ્યાન કરાયેલને મળવાપાત્ર લાભના ક્લેઈમ રજુ કરવાની મર્યાદા તથા ટેક્સટાઈલ સેક્ટરની Rebate of State and Central Levies Taxes (RoSCTL) Scheme અંતર્ગત નિકાસના લાભો માટે ક્લેઈમ રજુ કરવાની સમય મર્યાદા તા.૧૫-૩-૨૦૨૨ સુધી કરાયેલ છે. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કરાયેલ રજુઆતોને સફળતા મળેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની મુંબઈ સ્થિત IMC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં કો-ઓપ્ટ કારોબારી સભ્ય તરીકે નિમાણુંક...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૮ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા છે. રાજકોટ ચેમ્બર દ્વારા હર હંમેશા વેપાર-ઉદ્યોગના તેમજ આમ પ્રજાના પ્રશ્નોનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહે છે. તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં એક સેતુ બની રજુઆતો કરી ઉદ્ભવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. રાજકોટ ચેમ્બર મુંબઈ સ્થિત IMC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં સભ્યપદ ધરાવે છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની કો-ઓપ્ટ કારોબારી સભ્ય તરીકે નિમાણુંક કરવામાં આવેલ છે. IMC ની કો-ઓપ્ટ કારોબારી સમિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવને સ્થાન મળવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવની બાબત ગણાય. આમ આ સ્થાન મળવાથી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને ખુબ જ મહત્વ સાથે વાચા મળશે.

સાથો સાથ પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ હાલ નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ન્યુ દિલ્હીમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં અગાઉ રીજીઓનલ સેક્રેટરી જેવા મહત્વના પદ પર કાર્ય કરી ચુક્યા છે તેમજ કારોબારી સભ્ય તરીકે પણ હાલ કાર્યરત છે. આથી તમામ વેપાર-ઉદ્યોગકારોને તેઓને

ઉદ્ભવતા પ્રશ્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા પણ અનુરોધ કરવામાં આવે છે. જેથી તેની ઉચ્ચ લેવલે રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

સરકારશ્રીએ શરૂ કરેલ ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને પડતી મુશ્કેલી અંગે તથા મેન્યુઅલ સર્ટિફિકેટ માટે મુદત વધારવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ડીજીએફટી ન્યુ દિલ્હી સમક્ષ રજુઆત કરવામાં આવી...

સરકારશ્રીએ નિકાસકારોને ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજન માટે કોમન ડિઝીટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને ભોગવવી પડતી વિવિધ મુસીબતો બાબતે રાજકોટ ચેમ્બર દ્વારા સચોટ રજુઆત કરવામાં આવેલ જેના અનુસંધાને સરકારશ્રીએ સર્ટિફિકેટ ઓફ ઓરીજન મેન્યુઅલી ઈસ્યુ કરવા માટે ૩૧-૩-૨૦૨૨ સુધી મુદત વધારો કરી આપેલ. તેમ છતાં નિકાસકારોની ઘણીબધી મુસીબતોનું યોગ્ય નિરાકરણ ન થવાનું જણાતા રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ ડીજીએફટી ન્યુ દિલ્હી તથા રાજકોટ જોઈન્ટ ડીજીએફટી સમક્ષ નીચે મુજબ રજુઆત કરેલ છે.

(૧) પોર્ટલમાં કોલમનં.૭ માં નિકાસ કરેલ વસ્તુની વિગત દર્શાવવાની હોય છે. જેમાં એક કરતા વધારે નિકાસ વસ્તુઓના કિસ્સામાં દરેક આઈટમની જરૂરી વિગતો એક જ કોલમમાં ફાળવેલ માર્પોદિત જગ્યામાં દર્શાવી શકાતી નથી. તેથી કોલમ નં.૭ ની વિગત સમાવવા માટેની જગ્યા મોટી કરવી. અથવા આના વિકલ્પે એક અલગ સ્ટેટમેન્ટમાં તમામ વસ્તુઓની વિગત દર્શાવવી CoO ફોર્મમાં કોલમનં.૭ માં સાથે બીડિલ ફોર્મ મુજબ માન્ય રાખવું જોઈએ.

(૨) સર્ટિફિકેટ ઓફ ઓરીજનની ફીનું પેમેન્ટ કરવા માટે કોર્પોરેટ બેન્કીંગનું પ્રાવધાન પોર્ટલમાં કરવું ખાસ જરૂરી છે.

(૩) સર્ટિફિકેટ ઓફ ઓરીજન ઓનલાઈન જનરેટ કરતી વખતે નિકાસકારોએ નિકાસપાત્ર આઈટમ બનાવવા માટે કરેલ તમામ આયાતોની વિગતો આપવી ખુબ જ અસુવિધાજનક જણાય છે અને સમયનો વ્યય પણ થાય છે. જેનું તાત્કાલીક નિવારણ લાવવું.

(૪) સર્ટિફિકેટ ઓફ ઓરીજનના ચાર્જ પેટે એક પેઈઝ દીઠ રૂ.૨૩૬/- ફી નિર્ધારિત કરાયેલ છે. પરંતુ બે કે ત્રણ પેઈઝના કિસ્સામાં દરેક પેઈઝ દીઠ રૂ.૨૩૬/- ભરવાપાત્ર થાય છે. સદર જોગવાઈ તાત્કાલીક સુધારી પેઈઝ વાઈઝને બદલે સર્ટિફિકેટ ઓફ ઓરીજન વાઈઝ રૂ.૨૩૬/- ફી લઈ શકાય તેવી વ્યવસ્થા કરવી.

(૫) નિકાસકાર સિસ્ટમમાં ઈનવોઈસ અટેસ્ટેડ કરાવી શકે તેવી સુવિધા આપેલ છે. પરંતુ અન્ય સહાયક ડોક્યુમેન્ટ જેવા કે પેકિંગ લીસ્ટ વગેરે અટેસ્ટેડ માટે જોગવાઈ થયેલ નથી. તેથી નિકાસકાર તમામ ડોક્યુમેન્ટ અટેસ્ટેડ કરી શકે તેવી વ્યવસ્થા કરવી.

(૬) નિકાસકાર માટે ફાઈનલ ડેસ્ટીનેશન (અંતિમ સ્થળ) દેશ દર્શાવવાનું હોય છે. જે માટે ચેક લીસ્ટ પ્રોવાઈડ કરવામાં આવેલ છે. પરંતુ ચેકલીસ્ટમાં સામેલ ન હોય તેવા દેશમાં નિકાસના કિસ્સામાં જે તે દેશનું નામ સીસ્ટમ માન્ય રાખતી નથી. આવા સંજોગોમાં અન્ય ઓપ્શનનું પ્રાવધાન તાત્કાલીક કરવાની જરૂર છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉપરોક્ત તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ ન થાય ત્યાં સુધી મેન્યુઅલી ઈસ્યુ કરવાની સમય મર્યાદા વધારી ન્યુ દિલ્હી ડીજીએફટીશ્રી અમિત યાદવ સમક્ષ તથા રાજકોટ જોઈન્ટ ડીજીએફટી સમક્ષ ખાસ રજુઆત કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની રેલ્વે DRUCC માં નિમાણુંક કરવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની રેલ્વેની DRUCC કમિટિમાં નિમાણુંક થયેલ છે. સતત ૨૦૧૩ થી DRUCC ના મેમ્બર તરીકે કાર્યરત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને સારી રેલ્વે સુવિધા મળી રહે તથા વેપાર-ઉદ્યોગ અને આમ જનતાના રેલ્વેના પ્રશ્નોની સચોટ રજુઆતો કરી તેનો ઉકેલ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. રાજકોટ ચેમ્બર દ્વારા કરાયેલ સફળ રજુઆતો જેમા ખાસ કરીને રાજકોટ રેલ્વે સ્ટેશનમાં મુસાફરો માટે એસ્કેલેટરની સુવિધા શરૂ થઈ ગયેલ છે., લગેજ સ્કેનર મશીન મુકાવામાં આવેલ છે., રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નં.૩ ઉપર કોચ ગાર્ડન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે., રાજકોટ-મુંબઈ જવા માટે 'હમસફર એક્સપ્રેસ' ટ્રેઈન શરૂ કરવામાં આવેલ છે., રાજકોટ-અમદાવાદ શરૂ થયેલ દુરન્ટો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ છે. ઉપરાંત સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેનો ડબલ ટ્રેક પ્રોજેક્ટ ઝડપી પુરો થાય તે અંગે પણ ભારપૂર્વક રજુઆત કરેલ છે.

તદુપરાંત હજુ મુસાફરોને રેલ્વેની સારી સુવિધાઓ મળે તેવા પ્રયત્નો ચાલુ રાખીશું. જે કોઈને રેલ્વેના પ્રશ્નો હોય તો તે રાજકોટ ચેમ્બરને મોકલી આપવા ઉપપ્રમુખશ્રી પાર્થભાઈએ અનુરોધ કરેલ છે. જેથી તેની તાત્કાલીક રજુઆત કરી ઉકેલ લાવી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા FIEO ના સંયુક્ત ઉપક્રમે “Enhancing Export Business in the New Financial Year and Latest Updates” અંગે સેમિનાર યોજવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના સંયુક્ત ઉપક્રમે “Enhancing Export Business in the New Financial Year and Latest Updates” અંગે તા.૮-૪-૨૦૨૨, શુક્રવારના રોજ સેમિનાર યોજવામાં આવેલ.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ સાને આવકારી ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપવા રાજકોટ ચેમ્બર હંમેશા સજાગ છે. આયાત-નિકાસ અંગે ઉદ્યોગકારોને પુરતી માહિતી મળી રહે તે ઉદ્દેશથી અવાર-નવાર વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવા ચાલું થયેલ નાણાકિય વર્ષમાં નિકાસને વેગ મળે તે ઉદ્દેશથી આજના આ સેમિનારનું આયોજન કરેલ છે. જે ખુબ જ ઉપયોગી બની રહેશે. ત્યારબાદ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટમાં ઉદ્યોગોનો વિકાસ દિન-પ્રતિદિન વધતો રહે છે અને રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ હબ બની ગયેલ છે. ભારત દેશે નિકાસક્ષેત્રે ૪૦૦ બીલીયન ઇકોનોમીની સિદ્ધિ હાંસલ કરી છે. તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. જે આપણા માટે ગૌરવની બાબત છે. તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૫ ટ્રીલીયન ઇકોનોમી વિઝનને સાર્થક કરવામાં આપણે સૌએ સહભાગી બનીશું. સાથો સાથ વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ જાતની મુશ્કેલી અથવા પ્રશ્નો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપી તેનું સચોટપણે નિરાકરણ લાવીશું તેમ જણાવેલ.

સેમિનારના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજકોટ જોઈન્ટ DGFT શ્રી અભિશેક શર્માએ સેમિનારમાં હાજર રહેવા આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ. તેમજ MEIS ના મળવાપાત્ર લાભ માટેની અરજીઓ સ્વીકારવાની છેલ્લી તા.૧૩-૪-૨૦૨૨ છે તો આ અંગે કોઈપણ મુંઝવણ હોય તો જાણ કરવી. સરકારશ્રી દ્વારા AEO, EPCG, RoDTEP, વગેરે મહત્વની સ્કીમો વિશે વિસ્તૃત જાણકારી આપેલ તથા ડોમેસ્ટીક માર્કેટમાં ગુજરાતનું યોગદાન સાડું રહ્યું છે જે સારી બાબત ગણાય. નિકાસકારોને કોઈપણ મુશ્કેલી ઉદ્ભવે તો વિના સંકોચે રાજકોટ DGFT ઓફિસનો સપર્ક કરવા જણાવેલ.

સેમિનારના વક્તાશ્રી મિહીરભાઈ શાહએ આજના સેમિનારનું આયોજન કરવા તથા આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ. નિકાસક્ષેત્રે ભારત દેશે ૪૦૦ બીલીયન ઇકોનોમીની સિદ્ધિ હાંસલ કરેલ તેની સહર્ષ નોંધ લીધેલ. તેમજ નિકાસ અંગેના વિવિધ

પાસાઓની ચર્ચા કરી નવા નાણાકીય વર્ષમાં નિકાસને વધુ વેગ કેવી રીતે આપી શકાય તેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી જેમાં પાસ કરીને નિકાસકારોએ પોતાનું IEC દર ફાઇનાન્સીયલ વર્ષે અપડેટ કરવું, RCMC રીન્યું કરવું, GST LUT રીન્યું કરવું, DGFT ના કોમન પોર્ટલમાં શરૂ થયેલ સર્ટિફિકેટ ઓફ ઓરીજન અંગે, ICEGATE ના રજીસ્ટ્રેશન સાથે ADCODE / બેન્ક એકાઉન્ટ-ઈન્સ્ટેન્ટીવ લેજર અંગે, FTP ની મુદત ૩૦-૯-૨૨ સુધી વધેલ તે અંગે, એક્ષપોર્ટ ઈન્સેન્ટીવ, ઈન્ટરેસ્ટ ઈક્વીલાઈઝેશન સ્કીમ અંગે, ઓથોરાઈઝડ ઈકોનોમીક ઓપરેટર સ્કીમ અંગે, ન્યુ માર્કેટ-પ્રોડક્ટ તથા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ અંગે, એડવાન્ટેજ ઓફ એક્ષપોર્ટર્સ, વિગેરે વિવિધ મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી-માર્ગદર્શન આપેલ. બાદમાં ઉપસ્થિત નિકાસકારો દ્વારા પુછાયેલ પ્રશ્નોના વિગતવાર જવાબો આપી સમજાવવાના પ્રયત્નો કરેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન તથા ઉપસ્થિત મહાનુભાવો તથા સભ્યોશ્રીઓનો આભાર વ્યક્ત FIEO ના ગુજરાત વેસ્ટર્ન રીજીઓનલ હેડશ્રી જયપ્રકાશ ગોયેલએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને કોઈપણ મુશ્કેલી કે સમસ્યા હોય તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો સંપર્ક કરવા અનુરોધ...

કેન્દ્ર સરકાર દ્વારા નિકાસકારો માટે સર્ટિફિકેટ ઓફ ઓરીજન ઈશ્યું કરવા માટે નવેમ્બર-૨૦૨૧ થી કોમન ડિઝીટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને ભોગવવી પડતી વિવિધ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી DGFT દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી મુદત વધારવામાં આવેલ હતી. આ દરમ્યાન નિકાસકારોને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી રજુઆત કરી મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ લાવેલ છે અને હજુ પણ જ્યાં સુધી કોમન ડિઝીટલ પોર્ટલમાં મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી મેન્યુઅલી ચાલું રાખવા રજુઆત કરેલ છે.

હાલ ૧લી એપ્રિલ ૨૦૨૨ થી ફરજિયાત ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજન ઈશ્યું કરવાનું રહેશે. જે અંતર્ગત નિકાસકારોને પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવામાં કે એપ્લીકેશન સબમીટ કરવામાં કોઈપણ મુશ્કેલી કે સમસ્યા ઉદ્ભવતી હોય રાજકોટ ચેમ્બરના ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૪૦૦ / ૨૨૨૭૫૦૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. જેથી નિકાસકારોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



राजकोट चेम्बर ओफ़ कोमर्स अन्ड इन्डस्ट्रीना सडयोगथी फुड कोर्पोरेशन ओफ़ इन्डिया-राजकोट द्धारा AI Based Automated Grain Analyzer & Automatic Moisture Meter अंगे सेमिनार योजवामां आवेल.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી કુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા-રાજકોટ દ્વારા AI Based Automated Grain Analyzer & Automatic Moisture Meter અંગે તા.૧૨-૪-૨૦૨૨ ના રોજ સેમિનાર યોજવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા તથા કુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ન્યુ દિલ્હીના ચીફ જનરલ મેનેજરશ્રી એએસ અરૂણાયલમ, ગુજરાતના જનરલ મેનેજરશ્રી શ્રીકાંત પ્રસાદ, અમદાવાદના આસી.જનરલ મેનેજરશ્રી શિવકુમાર ચંદન તથા રાજકોટના ડી.એમ.શ્રીમતી રાખી નિલવાની ઉપસ્થિત રહેલ.

સેમિનારના પ્રારંભે FCI અમદાવાદના આસી.જનરલ મેનેજરશ્રી શિવકુમાર ચંદન દ્વારા સૌને આવકારી આજના આ સેમિનારનું આયોજન કરવા બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યક્ત કરેલ. તેમજ કુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે માહિતગાર કરેલ. ત્યારબાદ FCI ગુજરાતના જનરલ મેનેજરશ્રી શ્રીકાંત પ્રસાદએ ખાદ્ય નિગમ દ્વારા કોરોના કપરાકાળ દરમ્યાન લોકડાઉનમાં પરિવારોને અનાજ વિતરણ કરીને ઘણો સિંહ ફાળો આપ્યો છે. તેમજ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ બેઈઝ ઓટોમેટેડ મશીન અંગે ટુંકી માહિતી આપેલ. તેમજ આવા મશીન રાજકોટમાંથી ઉપલબ્ધ થવાથી ઔદ્યોગિક એકમોને વેગ મળશે તથા નિકાસમાં પણ વૃદ્ધિ થશે.

ત્યાર બાદ FCI ન્યુ દિલ્હીના ચીફ જનરલ મેનેજરશ્રી એએસ અરૂણાયલમ દ્વારા આજના આ સેમિનાર માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ માહિતી આપેલ. જેમાં ખાસ કરીને Quality Specifications, Uniform specifications of Paddy / Rice / Wheat KMS 2021-22, Pictorial depiction of refractions of Raw rice, Generic Specification of Automation Grain Analyzer, Generic Specification of Moisture Meter, Requirement of Automatic AI based grain analyser and moisture meter, Purchasing of equipments through GeM Portal, વિગેરે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરેલ.

ત્યાર બાદ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ કુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે. તેને બિરદાવી સમગ્ર દેશમાંથી માત્ર ચાર શહેરોમાંથી રાજકોટ ખાતે જ આવા મશીન બનાવવા માટેનો આગ્રહ દર્શાવેલ છે. જે સરાહનીય છે. ત્યારે રાજકોટના સમગ્ર ઔદ્યોગિક એકમો આવા મશીન બનાવવા ઉત્સાહ દાખવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમજ રાજકોટથી ૧ લાખથી પણ વધુ આવા ઓટોમેટેડ મશીન બનાવવા સાથે અને સહકાર આપવામાં આવશે તેવી આત્રી આપેલ.

સેમિનારના અંતે ઉપસ્થિત સભ્યશ્રીઓ તથા મહાનુભાવોનો આભાર વ્યક્ત તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન FCI રાજકોટના મેનેજરશ્રી એમ.જી પાટીલ દ્વારા કરવામાં આવેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાગવાનશ્રી મહાવીરની જયંતી નિમિત્તે યોજાયેલ ધર્મયાત્રાના વધામણા કરવામાં આવેલ...

રાજકોટ ખાતે ભાગવાનશ્રી મહાવીર જયંતીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવેલ. આ તકે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ વિશાળ ધર્મયાત્રા યોજાયેલ હતી. જેમાં શ્રદ્ધાળુઓ, મુની ભગવંતો, શ્રાવકો હર્ષ-ઉલ્લાસથી જોડાયેલ. આ પ્રસંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાગવાનશ્રી મહાવીરની યોજાયેલ વિશાળ ધર્મયાત્રાનું ઉત્સાહ પુર્વક હર વર્ષની જેમ અભિવાદન કરવામાં આવેલ.

આ તકે રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયા, કારોબારી સભ્યશ્રી અશોકભાઈ વિરડીયા, શ્રી અચ્યુતભાઈ જસાણી, શ્રી કલ્પેશભાઈ ડોબરીયા, શ્રી સત્યેનભાઈ પટેલ, શ્રી સમિરભાઈ વેકીરયા તથા શ્રી રાજેશભાઈ જુજા હાજર રહેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રેલ્વે ડીવીઝનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ક્લીન શીફ્ટ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની સતત ત્રીજી વખત રેલ્વેની ZRUCC ના સભ્ય તરીકે ભવ્ય બહુમતીથી ચૂંટાઈ આવતા થયેલ નિમાણુંક...

વેસ્ટર્ન રેલ્વે, રાજકોટ ડીવીઝનની, ડીવીઝનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટિ- ZRUCCની તા.૨૧-૪-૨૦૨૨ ના રોજ ડીવીઝનલ રેલ્વે મેનેજરશ્રી અનિલ કુમાર જૈન તથા ડીવીઝનલ કોમર્શીયલ મેનેજરશ્રી અભિનવ જૈનની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ કમિટિ સભ્યો માંથી સૌરાષ્ટ્ર લેવલે એક સભ્યનું નામ ZRUCC ના સભ્ય તરીકે મોકલવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા. પાર્થભાઈ ગણાત્રા નામ ઉપરાંત બે સભ્યોએ ઉમેદવારી નોંધાવેલ જેમા રાજકોટ રેલ્વે ડીવીઝનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ક્લીન શીફ્ટ થઈ અને ૧૦૦% મત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની તરફેણમાં મળતા તેઓની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટિ (ZRUCC) સભ્ય તરીકે ભવ્ય બહુમતીથી ચૂંટાઈ આવતા સતત ત્રીજી વખત નિમાણુંક થયેલ છે.

શ્રી પાર્થભાઈ ગણાત્રા ૧૨ વર્ષથી રેલ્વે કમિટિ સાથે સંકળાયેલ છે. તેમજ અગાઉ પણ આ પોસ્ટ ઉપર રહી તેઓએ રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને રેલ સુવિધામાં પડતી મુશ્કેલી અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરી મહદઅંશે સફળતા પણ મેળવેલ છે. રાજકોટ રેલ્વે સ્ટેશનમાં મુસાફરો માટે એસ્કેલેટરની સુવિધા શરૂ થઈ ગયેલ છે., લગેજ સ્કેનર મશીન મુકાવામાં આવેલ છે., રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નં.૩ ઉપર કોચ ગાઈડન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે., રાજકોટ-મુંબઈ જવા માટે 'હમસફર એક્સપ્રેસ' ટ્રેઈન શરૂ કરવામાં આવેલ છે., રાજકોટ-અમદાવાદ શરૂ થયેલ દુરન્તો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ છે.

ઉપરાંત તેઓએ રેલ્વેના વર્તમાન પ્રશ્નો જેવા કે સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેનો ડબલ ટ્રેક પ્રોજેક્ટ ઝડપી પુરો કરવા, કોઈપણ સંજગોમાં મુંબઈ સેન્ટ્રલ-લાપા વચ્ચે દોડતી દુરન્તો એક્સપ્રેસને બોરીવલી અથવા મલાડ સ્ટેશને સ્ટોપ આપવા, જામનગર-બાન્દ્રા ટ્રેન હમસફર એક્સપ્રેસ હાલ અઠવાડિયામાં ત્રણ વખત ચાલુ છે, જેને કાયમી ધોરણે ચાલુ કરવી, ઓખા-દેહરાદુન એક્સપ્રેસ અઠવાડિયામાં એક વખત જાય છે આ ટ્રેન હરિદ્વાર મુસાફરી કરનાર માટે ખુબ જ અનુકુળ અને ઉપયોગી હોવાને કારણે કમ સે કમ અઠવાડિયામાં ત્રણ વખત ચલાવવી, પોરબંદર થી દિલ્લી સરાઈ રોહિલા જતી ટ્રેન ૧૪ કલાક સરાઈ રોહિલા પડી રહે છે તેને બદલે આ ટ્રેનને હરિદ્વાર સુધી

લંબાવવી, અમદાવાદ-હરિદ્વારા દિલ્હી મેઈલ કાલુપુર સ્ટેશન પર ૧૪ કલાકનો લાંબો હોલ્ટ ધરાવે છે જેને રાજકોટ સુધી લંબાવવી, રાજકોટ થી ચેન્નઈ જવા માટે ડાયરેક્ટ ટ્રેનની કોઈ સુવિધા ન હોવાને કારણે મુસાફરોને વાયા અમદાવાદ જવું અને આવવું પડે છે. તેથી ચેન્નઈ-અમદાવાદ ટ્રેન નવજીવન એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવી, ઓખા-જોધપુર વચ્ચે કોઈ ડાયરેક્ટ ટ્રેનની સુવિધા ન હોવાથી અઠવાડીક ટ્રેન ચાલુ કરવી, ઓખા-દિલ્હી વચ્ચે અઠવાડીક ટ્રેન ચાલુ કરવી, રાજકોટ રેવા ટ્રેન હાલ અઠવાડીયામાં એક વખત જાય છે. જેને અઠવાડીયામાં બે વખત શરૂ કરવી, વગેરે પ્રશ્નોને કેન્દ્ર તથા રાજ્ય સરકાર અને ZRUCC તથા DRUCC મિટીંગોમાં પ્રધાન્ય આપી રાજકોટ ડીવીઝનને વધુ રેલ્વે સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશિલ રહેશે. તેથી રેલ્વેને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને મોકલી આપવા અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિની મિટીંગ યોજાયેલ જેમાં ત્રણ કો-ઓપ્ટ સભ્યોની સર્વાનુમતે વરણી....

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એપ્રિલ માસની કારોબારી સમિતિની મિટીંગ પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની અધ્યક્ષતામાં તા.૨૯-૪-૨૦૨૨ ના રોજ રાજકોટ ચેમ્બર હોલ ખાતે યોજાયેલ. જેમા એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ મિટીંગમાં બંધારણીય જોગવાઈ મુજબ ત્રણ સભ્યો (૧) શ્રી પંકજભાઈ ધમસાણીયા - સમય ટ્રેકટર્સ (૨) શ્રી કિશોરભાઈ વઘાસીયા - ભાગ્યોદય ટ્રેડિંગ કંપની (૩) શ્રી નરેશભાઈ શેઠ - આજી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનની કો-ઓપ્ટ સભ્ય તરીકે સર્વાનુમતે નિમાણુંક કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર દ્વારા આ મિટીંગમાં અલગ અલગ ક્ષેત્રના વિવિધ ૨૨ જેટલા એસોસિએશનોને પણ ખાસ આમંત્રિત તરીકે નિમાણુંક કરવામાં આવેલ. જેમા શ્રી જયેશભાઈ ઉપાધ્યાય-શ્રી બોલબાલા ચેરીટેબ ટ્રસ્ટ, શ્રી ડેનીશભાઈ હદવાણી-હરીપર પાળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, શ્રી સુજીતભાઈ ઉદાણી-રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન, શ્રી જયદિપભાઈ નંદાણી-રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન, શ્રી પ્રણંદભાઈ કલ્યાણી-ધર્મેન્દ્રોડ વેપારી એસોસિએશન, શ્રી દિપકભાઈ સચદે-કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સિલ, શ્રી મયુરભાઈ આડેસરા-જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન, શ્રી અરવિંદભાઈ શાહ-ગુજરાત મીનીસીમેન્ટ મેન્યુ. એસોસિએશન, શ્રી પ્રશાંતભાઈ સુચક-ખીરસરા જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, શ્રી જગદીશભાઈ અકબરી-રાજકોટ ડેરી મરચન્ટ એસોસિએશન, શ્રી હેમંતભાઈ કાપડીયા-રાજકોટ ક્રિચનવેર્સ મેન્યુ.એસોસિએશન, શ્રી રાજુભાઈ માણેક-રાજકોટ ટેક્સ્ટ કન્સલ્ટન્ટ સોસાયટી, શ્રી રમેશભાઈ હિરપરા-રામનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયા એસોસિએશન, શ્રી મનોજભાઈ ઉનડકટ-રાજકોટ ટી મરચન્ટ એસોસિએશન, શ્રી હસુભાઈ સોરઠીયા-વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, શ્રી નૈવેશભાઈ શાહ-અટીકા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, શ્રી પંકજભાઈ બાટવીયા-ગુંદાવાડી રોડ વેપારી એસોસિએશન, શ્રી કનકસિંહ ગોહિલ-મશીન ટુલ્સ મેન્યુ. એસોસિએશન, શ્રી પરેશભાઈ સાવલીયા-ટીવી એપ્લાયન્સીસ ટ્રેડર્સ એસોસિએશન, શ્રી નિતીનભાઈ નથવાણી-પરાબજર મરચન્ટ એસોસિએશન, શ્રી ગીરીશભાઈ પરમાર-પ્રતિક્ષા એનર્જી સોલ્યુશન, સી.એ. શ્રી ધવલભાઈ ખખખર-ઈશ્વર લક્ષ્મીદાસ ખખખર એન્ડ કંપની આમ બહોળી સંખ્યમાં એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.

ત્યારબાદ પરંપરાગત રાજકોટ ચેમ્બર દ્વારા દર વર્ષે સભ્યો પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની ની સફળ રજુઆત...
રેલ્વે તંત્ર દ્વારા ટ્રેઈનોમાં લગાવાશે બેબી બર્થ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા લોકોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તેમજ નવી ટ્રેઈનો શરૂ કરવા વિગેરે બાબતે અવાર-નવાર રેલ્વે ડિપાર્ટમેન્ટ તથા સરકારશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવે છે. જે અનુસંધાને રાજકોટ ચેમ્બર દ્વારા ટ્રેઈનોમાં મહિલા મુસાફરોની સાથે ૫ વર્ષ સુધીના બાળકો સફર કરતા હોય ત્યારે રાત્રી મુસાફરીમાં બાળકોની સંભાળ રાખવા માટે તથા સારી રીતે આરામ થઈ શકે તે માટે એક અલગ ફોલ્ડેબલ ટ્રે અથવા ટ્રોલીની વ્યવસ્થા યોગ્ય ચાર્જ લઈને કરવી તેમજ આ પ્રકારની સુવિધાઓ હાલ વિદેશોમાં મળી રહી છે તેવી રજુઆત અગાઉ ZRUCC મિટીંગમાં લેખિત રજુઆત કરવામાં આવેલ.

આમ આ રજુઆત સ્વીકાર થતા રેલ્વેતંત્ર દ્વારા હાલ લખનઉ મેઈલમાં બેબી બર્થ લગાવવામાં આવેલ છે. તેમજ આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં અલગ અલગ ટ્રેઈનોમાં અમલીકરણ કરવામાં આવશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા હોદ્દેદારોએ નવ નિયુક્ત પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સાહેબની શુભેચ્છા મુલાકાત લીધેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા અને માનદ્ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ રાજકોટ શહેરના નવ નિયુક્ત થયેલ પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સાહેબની શુભેચ્છા મુલાકાત લીધેલ.

આ મુલાકાત દરમ્યાન રાજકોટ ચેમ્બર દ્વારા શહેરની જનતા શાંતી અને સલામતી અનુભવે તેમજ કાયદો-વ્યવસ્થાનું સારી રીતે અમલ થાય તેમજ શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પોલીસ કમિશ્નરશ્રી સમક્ષ આગ્રહ પુર્વક રજુઆત કરવામાં આવેલ. તેમજ આ મુલાકાત અડધો કલાકથી પણ વધારે ચાલેલ હોય તેમાં રાજકોટ ચેમ્બર દ્વારા ઘણી બધી વાણઉકેલ સમસ્યાનું નિરાકરણ લાવવા અને આગામી ટુંક સમયમાં સાઈબર ક્રાઈમ અંગે અવરનેશ સેમિનારનું આયોજન કરવા જણાવેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર-ઉદ્યોગને નડતા કાયદાકીય પ્રશ્નો તેમજ રાજકોટ શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સાહેબની ઉપસ્થિતિમાં મિટીંગનું આયોજન કરવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર-ઉદ્યોગને નડતા કાયદાકીય પ્રશ્નો તેમજ રાજકોટ શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સાહેબની ઉપસ્થિતિમાં તા.૮-૬-૨૦૨૨ ના રોજ મિટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટીંગમાં પોલીસ કમિશ્નરશ્રી સહિત ડી.સી.પી. ઝોન-૧શ્રી પ્રવિણસિંહ મિણા સાહેબ, ડી.સી.પી. ઝોન-૨ શ્રીસુધિકુમાર દેસાઈ સાહેબ, કાર્દમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ અને ટ્રાફિક એ.સી.પી.શ્રી વી.આર. મલ્હોત્રા સાહેબ ઉપસ્થિત રહેલ.

મિટીંગના પ્રારંભે માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ, એસોસીએશનોને આવકારી રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય અને રાજકોટનાં વેપારીઓ અને પોલીસ સાથે મળીને કામ કરી શકે તે બાબતે ચર્ચા-વિચારણા માટે આ મિટીંગનું આયોજન કરેલ છે.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ રાજકોટ ચેમ્બરના આંગણે નવનિયુક્ત પોલીસ કમિશ્નરશ્રીએ સમય કાઢી હાજરી આપી તે બદલ સહૃદય આવકારેલ. રાજકોટ ચેમ્બર વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૮ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા અંગે ખ્યાલ આપતા રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રશ્નોની વિવિધ ઓથોરીટીમાં રજુઆત કરી એક સેતુ બની કાર્ય કરી રહ્યું છે. કોરોનાકાળ દરમ્યાન રાજકોટ ચેમ્બરની કામગીરી સી.એમ.એ પણ વખાણેલ છે. આગામી સમયમાં વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા વિવિધ ડીપાર્ટમેન્ટની સંકલન સમિતિની રચના કરાશે. રાજકોટમાં ખાસ કરીને કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન છે. જેમાં જીલ્લા પંચાયતમાં થતો ટ્રાફિક, આશાપુરા રોડ નાનો કટકો વનવે કરેલ તે તાત્કાલીક દુર કરવો, ગોંડલ રોડ ચોકડીએ થતા ટ્રાફિક જામ અંગે, હરિહર ચોકમાં વોકળાનો પ્રશ્ન, આર.એમ.સીના ઘણાં પ્લોટ ખાલી છે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવી, હોસ્પિટલ ચોકથી આગળ રેલ્વે સ્ટેશન રોડ પર બન્ને બાજુ શાક-બકાલાવાળાને દુર કરી ગેબનશાહપીરવાળા રોડ પર ફેરવવા, ટ્રાફિક વોર્ડનના થતા મિસબીલેવ્યર અંગે, ફોરવ્હીલમાં કાળા કાચની ઝુંબેશ વધુ ઝડપી બનાવવી, જે જગ્યાએ ઓવરબ્રીજ બને છે ત્યાં પ્રથમ સર્વિસ રોડ બનાવવા, રાજકોટના રહેણાંક

વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરો બંધ કરાવવા, તેમજ સાઈબર ક્રાઈમના ઘણા બનાવો બને છે તો તેને કાબુમાં લઈ આ અંગે રાજકોટ ચેમ્બર દ્વારા આગામી ટુંક સમયમાં સાઈબર ક્રાઈમ અંગે અવરનેશ સેમિનારનું આયોજન કરાશે તેમ જણાવેલ.

ત્યારબાદ સ્પ જટલા ઉપસૂચિત વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા તેઓના વિસ્તારમાં ઉદ્વતા ટ્રાફિક સમસ્યાઓની રજુઆત પોલીસ કમિશ્નરશ્રી સમક્ષ ધ્યાને મુકેલ અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા અનુરોધ કરેલ.

મિટીંગમાં ખાસ ઉપસ્થિત પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સાહેબએ રાજકોટ ચેમ્બર દ્વારા આ મિટીંગનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરેલ. તેમજ રાજકોટમાં પોલીસ કમિશ્નર તરીકે નવ નિયુક્ત થતા રાજકોટ ચેમ્બર સાથે આ પ્રથમ મિટીંગ થયેલ છે તે પ્રત્યે આનંદ વ્યક્ત કરતા રાજકોટ ચેમ્બર તથા વિવિધ એસોસિએશનનો દ્વારા કાયદાકીય વિવિધ પ્રશ્નો તેમજ ટ્રાફિક સમસ્યા અંગે જે જે રજુઆતો ધ્યાને મુકેલ છે તેનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરી યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું અને નો એન્ટ્રી તથા વનવેના જાહેરનામાનું યોગ્ય અભ્યાસ કરી કાર્યવાહી કરીશું, તેમજ રાજકોટ ચેમ્બરની માંગણીને ધ્યાને લઈ ટુંકા ગાળામાં સંકલન સમિતિની મિટીંગ યોજીશું અને આગામી રાજકોટ ચેમ્બરની આગમી કારોબારી મિટીંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલ કામગીરીનો રીપોર્ટ કાર્ડ પણ મોકલાવીશું, તેમજ ખાસ કરીને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પ્રજાએ ખાસ જાગૃતતા દાખવી નિયમોનું પાલન કરવા અનુરોધ કરેલ.

સતત બે કલાકથી પણ વધારે ચાલે મિટીંગમાં પોલીસ કમિશ્નરશ્રી તેમજ હોદ્દારોને સાથે રાખી તમામના પ્રશ્નોને સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ. ત્યારબાદ મિટીંગના અંતે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા ઉપસ્થિત અધિકારીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ તથા વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓનું મિટીંગમાં હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કરેલ અને સમગ્ર મિટીંગનું સંચાલન રાજકોટ ચેમ્બરના ખજાનચીશ્રી વિનોદભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને સભ્ય પરિવારનું સ્નેહ મિલન, ભોજન સમારંભ અને વિવિધક્ષેત્રે આગવું યોગદાન આપનારાઓનું સન્માન સાથે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ.....

વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ ૬૮ વર્ષની પીઠ મહાજન સંસ્થા "રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી"ના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહ મિલન, ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું તા.૧૨-૬-૨૦૨૨, રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ વધારવા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉદ્યોગમંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ, ટ્રાન્સપોર્ટમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો. ભરતભાઈ બોધરા, સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રામભાઈ મોહરીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા, મેયરશ્રી ડો. પ્રદિપભાઈ ડવ, ગુજરાત ગૌ સેવા આયોગના ચેરમેનશ્રી વલ્લભભાઈ કથીરીયા, તેમજ વિવિધ ખાતાના અધિકારીશ્રીઓ અને વિવિધ એસોસીએશન અને સૌરાષ્ટ્રની ચેમ્બરોના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના માનદ્ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ સર્વે ઉપસ્થિત મહાનુભાવો તથા સભ્યોનું સ્વાગત કરી રાજકોટ ચેમ્બરનો વિશાળ કાર્ય ફલકનો ખ્યાલ આપી વેપાર-ઉદ્યોગ અને શહેરી વિકાસ માટે આપ સૌના સાથ અને સહકારથી અમો સતત કાર્યશિલ છીએ. આમ સઃહૃદયે સૌનું સ્વાગત કરેલ હતું.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ ચેમ્બરના હોદ્દેદારો દ્વારા હાર તથા મોમેન્ટો અર્પી સન્માન કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પી કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર દ્વારા ઉચ્ચ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ તથા વેપાર-ઉદ્યોગ જગતના નામાંકીત ઉદ્યોગકારો તથા સમાજના વિશાળ હિતમાં પ્રેરણાદાયક કાર્ય માટે વ્યક્તિ વિશેષ તરીકે દિવ્યાંગ સ્મિત ચાંગેલા, લીડીંગ ટેક્ષ પેયર તરીકે બાલાજી વેફર્સ પ્રા.લિ., તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા.લિ., પુજારા ટેલીકોમ પ્રા. લિ., સ્વીમીંગ ગૃપમાં (બાંસુરી પી. મકવાણા, મૈત્રી બી. જોશી, વિશ્વા વી પરમાર, પ્રિશા એસ. ટાંક, વેનીશા એસ. શુક્લા, અવની આર. સાવલીયા, આર્યન બી. જોશી, વેદાંત એ. જોશી, પ્રતિક નાગર, કેયુર એન. રાજયગુડુ,) નિધીબેન અઢીયા(પાયલટ), હિનાબેન ભુવા (હિના ફાઉન્ડેશન)ને મોમેન્ટો અર્પી સન્માન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવેલ.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ સૌ પ્રથમ તો વરસાદી વાતાવરણમાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા અને ચેમ્બરની પ્રાણાલી જાળવી રાખવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સહૃદય આભાર સાથે સ્વાગત કરેલ અને રાજકોટ ચેમ્બર તેમજ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા સરકારશ્રીમાં અને વિવિધ ડીપાર્ટમેન્ટમાં એક સેતુ બની કાર્ય કરી મહત્વની ભુમિકા ભજવે છે. આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ હાજરી આપેલ હોય ત્યારે વેપાર-ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે,

(૧) સમગ્ર દેશમાં તમામ ટેક્ષાનો એકજ ટેક્ષા કરવાના નિર્ણયના ભાગરૂપે GST નું સરળીકરણ કર્યું જે સરાહનીય છે. વન નેશન વન ટેક્ષને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાંથી વેપાર-ઉદ્યોગ પરનો વ્યવસાય વેરો સંપૂર્ણ પણે નાબુદ કરવો. હાલમાં બજેટમાં સરકારશ્રીએ રૂ.૧૫૦૦૦ હજાર સુધીમાં પગારદાર લોકોને વ્યવસાય વેરા માંથી મુક્તી આપી છે. જેની રકમ આશરે રૂ.૨૦૦ કરોડ થાય છે અને ગુજરાતની કુલ આવક માત્ર રૂ.૩૦૦ કરોડ થાય છે તો માત્ર રૂ.૧૦૦ કરોડની આવક બીજે મેનેજ કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો નાબુદ થઈ શકે તેમ છે.

(૨) રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવવાની માંગણી ઘણા સમયથી પેન્ડીંગ છે. પુર્વ મુખ્યમંત્રીશ્રીએ આ માંગણીનો સ્વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે ૩૨ એકર જગ્યાનું સ્માર્ટ સીટી એરીયામાં પ્રોવીઝન કરેલ હોય આ અંગે તાત્કાલીક નિર્ણય લઈ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધું વેગવંતુ બનાવા રાજકોટ ચેમ્બરની માંગણી સ્વીકારી રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવવા બાબત.

(૩) રાજકોટ ચેમ્બરને પોતાની બિલ્ડીંગ બનાવવા માટે રાહત દરે જમીન ફાળવવા માટેની વર્ષો જુની માંગણી પેન્ડીંગ હોય. તો તાત્કાલીક અશરથી અમોને ૧૦ હજાર ચો.મીટર જગ્યા ટોકન દરે ફાળવવા બાબત.

(૪) રાજકોટ ખાતે ઈમિટેશન જવેલરી પાર્ક મંજૂર કરવું. કારણ કે, સમગ્ર ભારતમાં સૌથી વધારે ઈમિટેશનનું પ્રોડક્શન રાજકોટમાં થાય છે. આ ઉદ્યોગ ગુલુ ઉદ્યોગ હોય આશરે ૪.૫ લાખ લોકોને રોજગારી પુરી પાડે છે. જે પૈકી આશરે ૨.૫ લાખ મહિલાઓને રોજગારી મળે છે. તેથી રાજકોટ ખાતે ઈમિટેશન જવેલરી પાર્ક સ્થાપવાથી ઈમિટેશન ઉદ્યોગોને વેગ મળશે તેમજ લાખો લોકોને રોજગારી મળશે.

(૫) ઘણાં વખતથી ગુજરાતની GIDC ઓ ડબલ ટેક્ષ ભરવાથી પીડાય છે. તેમજ મહાનગરપાલિકા/ નગરપાલિકા તથા સરકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેથી ઔદ્યોગિક એકમોને મહાનગરપાલિકા તથા GIDC ને ભરવાપાત્ર થતા ડબલ ટેક્ષનું યોગ્ય નિરાકરણ લાવવા બાબત.

(૬) ઉદ્યોગકારોને મળવાપાત્ર તમામ સુવિધા મળે અને ઉદ્યોગોનો વિકાસ થાય. ગુજરાતમાં ઘણી બધી MSME ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ MSME ની મર્યાદા આશરે ૫૦ કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમાં રાખીને GIDC માં ૩૦૦૦ ચો.મી.ને બદલે જો ૬૦૦૦ ચો.મી. જમીન ઉદ્યોગકારોને ૫૦ ટકાના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ.એસ.એમ.ઈ સેક્ટરને બુસ્ટ મળશે.

(૭) તેમજ ગુજરાત સરકાર દ્વારા રેસીડિન્ટ સોસાયટીઓ રેગ્યુલારીઝ કરીને સરાહનીય પગલું લીધેલ છે. ત્યારે તમામ સુચિત ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ પણ તાત્કાલીક અસરથી ટોકન દરે રેગ્યુલારીઝ કરવી. આનાથી સરકારને રેવન્યુની આવક પણ વધશે તથા ઉદ્યોગોનો વિકાસ થશે. તેમજ આવી વસાહતોમાં આવારા તત્વો દ્વારા દબાણ પણ નહિ થાય તે પણ ધ્યાને લઈ ઘટતું કરવા બાબત.

(૮) રાજકોટ ખાતે રામનગર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઔદ્યોગિક એકમોને ધારાધોરણ મુજબની ફી લઈને રેગ્યુલારીઝ કરવાની માંગણી પેન્ડિંગ હોય તો તે અંગે ઘટતું કરવા બાબત.

(૯) રાજકોટ શહેરમાં અંદાજે ૧૭ વર્ષથી રૂડાના ચેરમેનની જગ્યા ખાલી હોય તેનો ચાર્જ શહેરના IAS અધિકારી પાસે હોય તેઓ પોતાના કાર્યભારના અભાવે હાજરી આપી શકતા ન હોય જેથી રાજકોટનો વિકાસ અટકી ગયેલ છે. તો માત્ર રાજકોટને જ આ અન્યાય શા માટે ? અમદાવાદ-બરોડા- સુરત-ભાવનગર જેવા શહેરોમાં ચેરમેનો હોય તો રાજકોટને કેમ નહીં ? તો રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની નિમણૂક કરી યોગ્ય કરવા બાબત.

(૧૦) આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે ડિકેન્સના હથીયારો ભારત દેશમાં જ બને અને ભારત આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી ડિકેન્સ અને એરોસ્પેસ પોલીસીને ખુબ પ્રોત્સાહીત કરેલ છે. રાજકોટમાં મોટા ભાગે ફોર્જિંગ તેમજ કાર્ટીંગના ઉદ્યોગો હોય તેમજ ઘણી બધી કંપનીઓ ડિકેન્સ સાથે જોડાયેલ હોય જો રાજકોટને ડિકેન્સના સાધનો બનાવવાનું હબ જાહેર કરે તો રાજકોટની આજુબાજુની આસરે ૧૮ હજાર એમ.એસ.એમ.ઈ.ને સીધો ફાયદો થશે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રની ૭૦ હજાર એમ.એસ.એમ.ઈ. ને પ્રાણ મળશે.

(૧૧) શહેરમાં સંચાલીત ચાલતા ડાયગ્નોસ્ટીક સેન્ટરોને તથા હેલ્થકેરને લગતા સાધનો વસાવવા માટે હેલ્થકેર પોલીસીમાં ફેરફાર કરી તેઓને સબસીડી મળવાપાત્ર થાય તેવી જોગવાઈ કરવા યોગ્ય કરવા બાબત.

જેવા વિવિધ મુદ્દાઓ મુખ્યમંત્રીશ્રીના ધ્યાન પર મુકી તાત્કાલીક નિરાકરણ લાવવા અનુરોધ કરેલ. તેમજ આજરોજ બપોરે મળેલ ફેરેશનની મિટીંગમાં ૪૦ થી પણ વધારે ચેમ્બરો તથા એસોસીએશનોના સભ્યોની આવેલ રજુઆતના વિવિધ પ્રશ્નો પણ ટૂંક સમયમાં માનનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન પર મુકવામાં આવશે.

કાર્યક્રમના મુખ્યમહેમાનશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપેલ તે બદલ સહય આભારની લાગણી વ્યક્ત કરતા જણાવેલ કે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતને પ્રોથ એન્જીન બનાવેલ છે. જેમા મહદઅંશે ફાળો વેપાર-ઉદ્યોગકારોનો રહેલો છે અને કોઈ પણ પાર્ટસ બનાવવા માટેના પ્રોજેક્ટ રાજકોટને આપવામાં આવે તો તે બે જ દિવસમાં પરિપૂર્ણ કરી આપે છે. તેમજ વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ બાબતો મુશ્કેલી કે તકલીફ થતી હશે તો તેના નિરાકરણ માટે સરકાર હંમેશા તેઓની સાથે છે. રાજકોટ ચેમ્બર દ્વારા રજુ કરાયેલ તમામ પ્રશ્નો ધ્યાને લઈ આગામી ટૂંક સમયમાં વિવિધ અધિકારીઓને સાથે રાખી ગાંધીનગર ખાતે ઓપનહાઉસ યોજી તમામ પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં લાવવા ખાત્રી આપેલ છે.

પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવએ આ તમામ પ્રશ્નોની પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ સાથે કરી આ અંગે તાત્કાલીક ઘટતું કરવા આગ્રહ રાખેલ.

કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ સ્નેહમિલનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીશ્રીઓ, ચેમ્બરના સભ્ય પરિવાર અને પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓનું કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.